BETEX INDIA LIMITED

CIN: L17119GJ1992PLC018073

CORPORATE OFF.: 504, TRIVIDH CHAMBER, 5TH FLOOR, OPP. FIRE BRIGADE STATION,

RING ROAD, SURAT - 395 002, INDIA.

Phone: (91-261) 2328902 Fax: (91-261) 2334189

E-mail: corporate@betexindia.com

Date: 31/05/2022

To, Department of Corporate Services

BSE Limited Phiroze Jeejeebhoy Towers,

Dalal Street, FORT, Mumbai: 400 001

Scrip Code: 512477

SUB. : Copy of Newspaper Advertisement in respect of Financial Results for the 04th quarter and Year ended on 31st March, 2022.

Dear Sir / Madam,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are submitting herewith a copy of newspapers cutting in respect of Audited Financial Results of the Company for the 4th quarter and Year ended on 31st March, 2022 published in the 'Financial Express' English Edition, Ahmadabad and 'Financial Express' Gujarati Edition (Regional Language), Ahmadabad on 31/05/2022.

This is for your information and record please.

Thanking You

FOR BETEX INDIA LIMITED

PRIYANKA GOHEL

(Company Secretary & Compliance Officer)

Encl.: As above

PLACE:- AHMEDABAD.

DATE:- 30-05-2022



Phones: 011-23357171, 23357172, 23705414, Website: www.pnbhousing.com

BRANCH ADDRESS:-, Unit No-203, Second Floor, Sai Midas Touch, Nagar-Manmad Road, Finance Limited Near Panchsil Hotel, Savedi, Ahmednagar, Maharashtra 414003, Email: ahmedabad@pnbhousing.com

AUTHORIZED OFFICER.

PNB HOUSING FINANCE LTD.

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTIES)

Whereas the undersigned being the Authorised Officer of the PNB Housing Finance Ltd. under the Securitisation and Reconstruction of Financia Assets & in compliance of Rule 8(1) of Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued demand notice/s on the date mentioned against each account calling upon the respective borrower/s to repay the amount as mentioned against each account within 60 days from the date of notice(s)/ date of receipt of the said notice/s. The borrower/s having failed to repay the amount, notice is hereby given to the borrower/s and the public in general that the undersigned has take possession of the property/ies described herein below in exercise powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 o the said Rules on the dates mentioned against each account

The borrower/s in particular and the public in general is hereby cautioned not to deal with the property/ies and any dealing with the property/ies will be subject to the charge of PNB Housing Finance Ltd., for the amount and interest thereon as per loan agreement. The borrowers' attention is invited to provisions of Sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

S. No.	Loan Account No.	Name of the Borrower/Co-Borrower /Guarantor	Date of Demand Notice	Amount Outstanding	Date of Possession Taken	Description of the Property Mortgaged
1.	HOU/AHM/ 0816/311339 B.O.: Ahmedabad	Amitkumar Upendrasingh Rajput & Upendra Singh S Rajput	09-01-2020	Rs. 15,36,565.30/- (Rupees Fifteen Lakhs Thirty Six Thousand Five Hundred Sixty Five & Thirty Paise Only) as on 09-01-2020	28-05-2022 Physical	Block U, Fourth, 403, Devnandan Supremus, Nr. Galaxy Township, Opp. RAF Campus, Vastral, Ahmedabad, 772/2, F.P. No-30/2, DTP No-114, Ahmedabad, Gujarat-382418
2.	HOU/AHM/ 0516/289134 B.O.: Ahmedabad	Mudliyar & Kushbu	04-03-2020	Rs. 14,51,561.99 (Rupees Fourteen Lakhs Fifty One Thousand Five Hundred Sixty One & Ninety Nine Paisa Only) as on 04-03-2020	28-05-2022 Physical	Block Z3-203,2,203,Devnandan Supremus,Nr. Galaxy Township, Opp. RAF Campus, Vastral, Ahmedabad, 772/2, F.P. No-30/2, DTP No-114, Ahmedabad,Gujarat-382418,India
3.	HOU/AHM/0 119/640729 B.O.: Ahmedabad	Dineshbhai Kashiram Patel & Jayaben Dineshbhai Patel	08-04-2021	Rs. 48,22,825.86 (Rupees Fourty Eight Lakhs Twenty Two Thousand Eight Hundred Twenty Five & Eighty Six Paisa Only) as on 31-03-2021	28-05-2022 Physical	Block D, 2.0, 203.0, DEVASYA STATUS, Nr. Bhakti Circle, Opp. Saurashtra Patel, Samaj Wadi New Nikol, F.P. NO. 211, 214, 215, Ahmedabad, Gujarat-380060

Public Notice For E-Auction For Sale Of Immovable Properties

Sale of Immovable property mortgaged to IIFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL-HFL) Corporate Office at Plot No.98, Udyog Vihar, Phase-IV, Gurgaon-122015 (Haryana) and Branch Office at:- 303, 3rd Floor, Bhagwandas Chambers, Opp, Circuit House, R. C Dutt Road, Vadodara, Pin Code-390007/Ahmedabad Commerce House, 4th Floor, Commerce House 4, Nr. Shell Petrol Pump, Anandnagar Road Frahladnagar, Ahmedabad-380051 under the Security Interest Act, 2002/here-inafter "Act"). Whereas the Auhorized Officer ("AO") of IIFL-HFL had taken the possession of the following property/ies pursuant to the notice issued U/S 13(2) of the Act in the following loan accounts/prospect nos. with a right to sell the same on "AS IS WHERE IS BASIS & AS IS WHAT IS BASIS" for realization of IIFL-HFL's dues, The Sale will be done by the undersigned through e-auction platform provided at the website: www.bankeauctions.com.

Borrower(s) / Demand Notice | Description of the Immovable | Deta of Reasenage | Reasena

Co-Borrower(s)/Guarantor(s)	Demand Notice Date and Amount	property/ Secured Asset	Dat	e of Possession	Reserve Price
1. Mr. Shaileshbhai	06-Oct-2021	All that part and parcel of the		18-May-2022.	Rs.19,16,400/- (Rupees Nineteen Lakh
Ambalal Parmar 2. Mrs.Truptiben Shaileshbhai Parmar	I nousand One Hundred	property bearing Tower D-1 Flat No.302, 0, Kuber Expressions, Opp. Kuber City, Vadodara,	Date: 18-May - 2022 Rs.22,41,782/- (Rupees Twenty Two Lakh Forty One		Sixteen Thousand Four Hundred Only)
(Prospect No 808676)	Ninety Nine Only) Bid Increase Amount Rs.25,000/- (Rupees Twenty Five Thousand Only)	Kauprai Crossing Waghodiya Road, Vadodara, Gujarat, India (Built Up area:- 1100.00 Sq.ft)			Rs.1,91,640/- (Rupees One Lakh Ninety One Thousand Six Hundred Forty Only)
Hitendrasinh Bhupatsinh Rathod Arunaben	27-Jan-2020 Rs.10,92,769/- (Rupees Ten Lakh Ninety Two Thousand Seven	All that part and parcel of the property bearing Flat No.H-702, 7th Floor, 30 .17 sq mtrs, (Carpet		Physical Possession 20-May-2022 Outstanding As On	Rs.9,62,000/- (Rupees Nine Lakh Sixty Two Thousand Only)
Bhupatsinh Rathod (Prospect No. 830640)	Hundred and Sixty Nine Only) Bid Increase Amount Rs.20,000/- (Rupees Twenty Thousand Only)	Area), Rashmi Vihar, Nr. Umang Lmabha, Bh. Sunrise Hotel, Narol Aslali Road, Ahmedabad.	Date: 24-May - 2022 Rs.9,23,813/- (Rupees Nine Lakh Twenty Three Thousand Eight Hundred Thirteen Only)		Earnest Money Deposit (EMD) Rs.96,200/- (Rupees Ninety Six Thousand Two Hundred Only)
Date of Inspection of property29-Jun-2022 1100 hrs - 1400 hrs		EMD Last Date 01-Jul-2022 till 5 pm	Date/ Time of E-Auction 05-Jul-2022 1100 hrs-1300 hrs		

Mode of Payment:- All payment shall be made by demand draft in favour of "IIFL Home Finance Limited" payable at Gurugram or RTGS/NEFT The accounts details are as follows: a) Name of the account:- IIFL Home Finance Ltd., b) Name of the Bank:- Standard Bank Ltd., c) Account No:-53105066294, d) IFSC Code:-SCBL0036025 or through Payment Link: https://quickpay.iififinance.com

- TERMS AND CONDITIONS:-
- TERMS AND CONDITIONS:

 1. For participating in e-auction, Intending bidders required to register their details with the Service Provider https://www.bankeauctions.com , well in advance and has to create the login account, login ID and password. Intending bidders have to submit / send their "Tender FORN" along with the payment details towards EMD, copy of the KYC and PAN card at the above mentioned Branch Office.

 2. The bidders shall improve their offer in multiple of amount mentioned under the column "Bid Increase Amount". In case bid is placed in the last 5 minutes of the closing time of the auction, the closing time will automatically get extended for Simulutes.

 3. The successful bidder should deposit 25% of the bid amount (after adjusting EMD) within 24 hours of the acceptance of bid price by the AO and the balance 75% of the bid amount within 15 days from the date of confirmation of sale by the secured creditor. All deposit and payment shall be in the prescribed mode of payment.

 4. The purchaser has to bear the cess, applicable stamp duty, fees, and any other statutory dues or other dues like municipal tax, electricity charges, land and all other incidental costs, charges including all taxes and rates outgoings relating to the property.

 5. Bidders are advised to go through the website thitps: //bankeauctions.com and https://www.iff.com/home-loans/properties-for-auction for detailed terms and conditions of auction sale & auction application form before submitting their Bids for taking part in the e-auction sale proceedings.

 6. For details, help procedure and online training on e-auction prospective bidders may contact the service provider E-mail ID: support@bankeauctions.com, Support Helpline Numbers: @ 7291981124/25/26 and any property related query Mr. Rajian Sharma @ 9979378887, E-Mail: rajjan.sharma@iffl.com

 7. Notice is hereby given to above said borrower/s, that in case they fall to collect the above said articles same shall be sold in accordance with Law, loss of property will be again put to sa

- STATUTARY 30 DAYS SALE NOTICE UNDER RULE 8 (6) OF THE SARFAESI ACT, 2002

The Borrower are hereby notified to pay the sum as mentioned above along with upto dated interest and ancillary expenses before the date o nder/Auction, failing which the property will be auctioned/sold and balance dues if any will be recovered with interest and cost Sd/- Authorised Officer, IIFL Home Finance Limited Place:- Baroda, Date: 28-May-2022

Adani Housing Finance Private Limited

Registered Office: Shikhar, Nr. Mithakhali Circle, Navrangpura, Ahmedabad-380009, Gujarat, India Corporate Office : One BKC, C-Wing, 1004/5, 10th Floor, Bandra Kurla Complex, Bandra (East), Housing Mumbai 400 051. Maharashtra, India. Finance CIN: U65999GJ2017PTC098960, Website: www.adanihousing.ir

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTIES)

Whereas the undersigned being the Authorised Officer of the Adani Housing Finance Private Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets & in compliance of Rule 8(1) of Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued demand notice/s or the data and activated assistance and the security Interest (Enforcement) Rules 2002, issued demand notice/s or powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued demand notice/s of the date mentioned against each account calling upon the respective borrower/s to repay the amount as mentioned against each account within 60 days from the date of notice(s)/date of receipt of the said notice/s.

The borrower/s having failed to repay the amount, notice is hereby given to the borrower/s and the public in general that th undersigned has taken possession of the property/ies described herein below in exercise powers conferred on hi Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned against each account.

The borrower/s in particular and the public in general is hereby cautioned not to deal with the property/ies and any dealing with the property/ies will be subject to the charge of Adani Housing Finance Private Ltd., for the amount and interest thereon as per loan agreement. The borrowers' attention is invited to provisions of Sub-section (8) and (9) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

	Sr. No.	Loan A/C No./ Old Loan A/C No	Name of the Borrower/ Co Borrower/ Guarantor	Demand Notice date & Amount	Symbolic/ Physical Possession on
		8000HL001016697 JAMAHL000010224	Mahesh Manilal Jagathiya Sonal Maheshbhai Jagathiya	23-Nov-21 / Rs. 365616/- As On Date 23-Nov-21	28-May-22 Symbolic Possessior
Mortgage Property address					

All That Pieces and Parcels Of Immovable Property Of Residential Open Plot No. 235/7 Admeasuring 46.54 Sq.Mtrs. Of Land Bearing R.S.No. 19 Of Village Chela, Tal.And Dist. Jamnagar Which As Converted Into Non Agricultural Residential Land By The Order Of Jamnagar Area Development Authority And Collector Jamnagar. Which Is Bounded As Under: East: Plot No 251 West: Pand North: Sulb Plot No 2516 South: Sulb Plot No 2516 South Sulb Plot No

25	51 West: Road, North: Sub Plot No 235/6, South: Sub Plot No 235/8.				
Sr.	Loan A/C No./	Name of the Borrower/	Demand Notice	Symbolic/ Physical	
No.	Old Loan A/C No	Co Borrower/ Guarantor	date & Amount	Possession on	
2	8010HL001016691 SURAHL000011032	Ganesh Jayram Desai Jayshree Jairam Desai	14-Dec-21/ Rs. 8,24,188.00/- As On Date 10-Dec-21	26-May-22 Symbolic Possession	
		Mortgage Prope	rtv address		

All that the Piece and Parcel of Property Flat No: 301 On the 3rd Floor Of The Building Known As "Sai Ashirwad Palace" Situated At: Bagumara Bearing Revenue Survey: 93/1, Block No: 121 Paiki Plot Nos.: 258 And 259 Of The Society Known As "Sai Darshan Residency" Of Village: Bagumara Taluka: Palsana, District: Surat. Which is Bounded As Under:- East: Adj. Property, West: Flat No 304 / Stairs North: Flat No 302, South: OTS

Sr.		Name of the Borrower/	Demand Notice	Symbolic/ Physical
No.		Co Borrower/ Guarantor	date & Amount	Possession on
3	8000HL001016503	Niraj Ajit Neel	24-Jan-22 / Rs.23,08,370.00/-	25-May-22
	ABDAHL000009624	Ashaben Neel	As On Date 24-Jan-22	Symbolic Possession

Mortgage Property address All That Piece And Parcel Property Bearing Plot No. 14 And 14-A, Gram Panchayat House No. 151 (Admeasuring About 500 Sq Yards & Construction There On 264 Sq. Yards) Situated On Survey No. 187 Paiki & 189 Paiki Mauje Narol (Ranipur Gamtal) Taluka Maninagar Dist & Sub District Ahmedabad. Which is Bounded As Under :- East : Property Of Aliyazar Yoman And Vilfered Martin, West: Property Of Dhirailal Yohan North: 20 Ft Road South: 10 Feet Road

Sr.	Loan A/C No./	Name of the Borrower/	Demand Notice	Symbolic/ Physical		
No.	Old Loan A/C No	Co Borrower/ Guarantor	date & Amount	Possession on		
	8000HL001020312	Maheshkumar Manubhai Raulji 24-Jan-22/ Rs. 9,39,583.00/-		26-May-22		
	NADAHL000010512	Ritaben Maheshkumar Raulji As On Date 24-Jan-22		Symbolic Possession		
	Mortgage Property address					

All That Piece And Parcel Moje Nesh House No. 292, Admeasuring 480 Sq Mtrs Ta-Thasra Dist - Kheda. **Which is Bounded As Under :- East** : House Of Ramsinh Jivantsinh **West** : House Of Bhikhabhai Becharbhai **North** : House Of Ajitbhai Devubhai **South** : House Of Sajanben Udesinh

Sr. No.	Loan A/C No./ Old Loan A/C No	Name of the Borrower/ Co Borrower/ Guarantor	Demand Notice date & Amount	Symbolic/ Physical Possession on		
5	8010HL001034686	Niku Kumar / Manti Devi Kundan Prasad	16-Mar-22 / Rs. 678737/- As On Date 16-Mar-22 Symbolic Possessi			
	Mortgage Property address					

All That Piece And Parcel Property Of Flat No. 305, 3rd Floor, Building No. A, Known As Golden Palace, Situated Bearin Revenue Survey No. 3691, 368, 390 And 389 Block No. 536/A, Paliki Plot Nos. 1 To 5, Of The Society Known As Narayanmuni Nagar Of Village Sayan, Taluka Olpad, District-Surat, Admeasuring About 304.51 Square Feet, I.E., 28.30 Square Meter (Carpet Area), Admeasuring About 337.00, Square Feet I.E 31.32 Square Meter, (Build Up Area) And 581.03 Square Feet (Super Build Up Area). Which is Bounded As Under: - East: Passage West: Adj. Building North: Flat No. 306 South: B-Wing

Sr. No.	Loan A/C No./ Old Loan A/C No	Name of the Borrower/ Co Borrower/ Guarantor	Demand Notice date & Amount	Symbolic/ Physical Possession on		
6	8010HL001042161	Deep Chand Deep Mala Thakur	16-Mar-22 / Rs. 688239/- As On Date 16-Mar-22	26-May-22 Symbolic Possession		
	Mortgage Property address					

All That Piece And Parcel Property Of Flat No. 104, 1st Floor, Building Known As Sanskar Villa Part - A, Situated At Tantithaiya Bearing Revenue Survey Nos. 256/3, And 256/2 + 260, Block No. 182 Paiki Plot Nos. 324 To 330 Of The Society Known As Mahadev Residency Part -2, Of Village Tantithaiya, Taluka - Palsana, District - Surat, Admeasuring About 644.00 Square Feet (Super Build Up Area) And Admeasuring About 355.00 Square Feet (Super Build Up Area). Which is Bounded As Under:- East: Open Space West: Entry And Passage Lift North: Open Space And Adj. Building South: Flat No. 105

l	Sr. No.	Loan A/C No./ Old Loan A/C No	Name of the Borrower/ Co Borrower/ Guarantor	Demand Notice date & Amount	Symbolic/ Physical Possession on
l	7	8010HL001039484	Puneet Pandey / Mira Devi Pandey / Shyamsundar Pandey	16-Mar-22 / Rs. 823906/- As On Date 16-Mar-22	26-May-22 Symbolic Possession
ı	Mortgage Property address				

All That Piece And Parcel Property Of Flat No. 203, 2Nd Floor, Building Known As "Rudraksh Avenue", Situated At Jolva Bearing Revenue Survey No. 182, Block No. 223 Paiki, Plot Nos, 126, 127, 128, 141, 142 And 143, Total Admeasuring About 532.22 Square Feet, I.E 63.20 Square Meters (Super Build Up Area) And 386.18 Square Feet I.E 35.89 Square Meter (Build Up Area). Which is Bounded As Under: - East: Flat No. 202 West: Flat No. 204 North: Passage South: Open Plot

Place: GUJARAT For Adani Housing Finance Private Limited : 31.05.2022 ારમાં ત્રુટી અથવા વિસંગતતા હશે તો અંગ્રેજી સંસ્કરણ માન્ય રહેશે.

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2022 (₹ in Lakhs)

Sr. No	PARTICULARS	QUARTE	R ENDED	YEAR I	ENDED
		31.03.2022	31.03.2021	31.03.2022	31.03.2021
		(Audited)	(Audited)	(Audited)	(Audited)
1	Total Income from Operations (net)	1609.45	1946.84	5837.04	4881.51
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	9.22	92.09	58.37	288.10
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	9.22	92.09	58.37	288.10
4	Net Profit / (Loss) for the period after tax (after- Exceptional and/or Entraordinary items)	8.44	94.41	40.91	206.43
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	8.44	94.41	40.91	206.43
6	Equity Share Capital	150.00	150.00	150.00	150.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	•	•	2366.17	2325.26
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)				
	1. Basic	0.56	6.29	2.73	13.76
	2. Diluted	0.56	6.29	2.73	13.76

The above is an extract of the detailed format of Audited Financial Results for the quarter & year ended 31st March, 2022, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results are available on the website of the Stock Exchange(s). BSE: www.bseindia.com and the Company's website:www.betexindia.com For, BETEX INDIA LIMITED

PLACE: SURAT Manish Somani WHOLETIME DIRECTOR DATE : 30/05/2022 CIN: L17119GJ1992PLC018073

436, GIDC, Pandesara, Surat-394221, Gujarat, INDIA. Ph.: (91-261) 2898595, FAX: (91-261) 2334189, E-mail: corporate@betexindia.com

CAPRI GLOBAL CAPITAL LIMITED ÁPRI GLOBAL

Registered & Corporate Office: - 502, Tower-A, Peninsula Business Park, Senapati Bapat Marg, Lower Parel, Mumbai-40001

Authorised Officer

Circle Office :- Capri Global Capital Limited 2nd Floor ,3B Pusa Road Rajendra Place, New Delhi-110005 APPENDIX IV POSSESSION NOTICE (for immovable property)

Whereas, the undersigned being the Authorized Officer of Capri Global Capital Limited (CGCL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s)/Guarantor(s) and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of the Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement rules, 2002. The borrower's attention is invited to provisions of sub -section (8) of section 13 of the Act, in respect of time available, to redeemth secured assets. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of CGCL for an amount as mentioned herein under with nterest thereon

S. N.		Description of Secured Asset (Immovable Property)	Demand Notice Date & Amount	Date of Possession
1.	(Loan Account No. LNMENAR000023018 of our Naroda Branch) Jagdish Kantilal Sharma (Borrower) Rajuben Jagdishbhai Sharma, Champaben Kantilal Sharma (Co-Borrower)	Survey No. 145/1, of the Registration Sub-District and District Ahmedabad - 6 (Naroda), Taluka Dascroi, Sabarmati-Gandhi Nagar Highway Road, District Ahmedabad, Gujarat – 380005; and Bounded as: East By: Property of Unit No. 109 with Common Wall West By: Passage and Gallery North By: Property of Unit No. 103 South By: Passage and Gallery Property No. 2 All Piece and Parcel of Property bearing Shop No. 109, 1st Floor, Admeasuring 250 Sq. Ft. i.e., 23.22 Sq. Mts., and undivided share of 12.83 Sq. Mts., in the scheme known as Sahyog Plaza, Opposite Vishwakarma Engineering College, situated at Mouje Motera on the land bearing Final Plot No. 85 of T.P. Scheme No. 21 of Survey No. 145/1, of the Registration Sub-District and District Ahmedabad - 6 (Naroda), Taluka Dascroi, Sabarmati-Gandhi Nagar Highway Road, District Ahmedabad, Gujarat – 380005. Bounded as:- East By: Passage and 24 Meters Road West By: Passage and Toilet North By: Property of Unit No. 103 with Common Wall South By: Passage then 18 Meters Road	16-03-2022 Rs. 35,84,024/-	25-05-2022
l P	Place: Ahmedabad Date: 31/05/2	022 Sd/- (Authorised Officer) For Cap	ri Global Capital I	Limited (CGCL)

Bank Regional Office: Netaji Marg, Nr. Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad-6. Phone: +91-79-26421671-Ellisbridge, Ahmedabad-6. Phone: +91-79-26421671-75

Demand Notice to Borrowers

The under mentioned account turned into N.P.A and demand notice is issued by Bandhan Bank Ltd. to the following borrower(s) under sec.13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act (The Act), 2002 which was returned unserved. Hence, this notice is issued to you all and public at

large through publication.				
Name of borrower(s),	Description of mortgaged property (Secured Asset)	Date of Demand	O/S Amount as on Date	Date of Pasting
Loan Account No.		Notice/ Date of NPA	of Demand Notice	of Notice
Shri Nayankumar	All that piece and parcel of the immovable property admeasuring about 67.33	11.5.2022/	Rs.11,58,056.90	21.05.2022
Vallabhabhai Devdiya	sq.mtr., Survey No. 697/3 Paiki Final Plot No., Survey 697/3, Block/Building	09.05.2022		
Smt Hetalben Gokalbhai	No. B, House No. 502, Floor: 5th Floor, Building/Society Name: Satvasharda-I;			
Naina	Nr. Shalby Hospital, Naroda-Nikol Road, Ahmedabad, City/Taluka: Ahmedabad			
111/1662	City, Gujarat, Pin code-382430 and bounded by:			
	North: Flat No. B-505, East: Flat No. B-501, West: Flat No. B-503, South:			
	Society Common Plot			

Demand made against you through this notice to repay to the Bank dues mentioned against your name with interest, costs and charges within 60 days from the date hereof failing which the Bank will further proceed to take steps u/s.13(4) of the SARFAESI Act. The borrowers'/mortgagors' attention is invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Place: Ahmedabad Date: 31/05/2022

Authorised Officer Bandhan Bank Limited

Loss of Share Certificate

NOTICE is given that the below mentioned securities of Mehta Housing Finance Ltd. Registered Office: Plot No. 1/A, Revenue Survey No. 203, P1, Savarkundla Road, Taveda, Mahuva, Bhavnagar-384290 have been lost by us.

Any person having a claim on the securities should lodge the said claim with the Company at its Registered Office within 15 days from this date, else the Company will issue duplicate certificate without further intimation.

No. of Securities: 100 Distinctive Nos. : 01732801 to 01732900 Name of holders: Raiuben Haresh Varandani & Haresh Ramchand Varandani

Rajuben Haresh Varandani & Date: 30-05-2022 | Place: Gandhinagar Haresh Ramchand Varandani

(1) IDBI BANK Bhagyoday House, Siddhanath Road, Opp.Krishna Talkies Vadodara - 390001

Appendix-IV[Rule-8(1)] - POSSESSION NOTICE - (For Immovable Property Whereas, The undersigned being the authorized officer of the IDBI Bank Limited (IDBI), Siddhanath Road Branch, Vadodara, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 29-11-2021 calling upon the borrower Mr. Tolia Mayur Chhotalal to repay the amount mentioned in the notice being Rs. 4,68,012.12 (Rupees Four Lakh Sixty Eight Thousand Twelve & Paisa Twelve Only) with further interest from mentioned in the notice and incidental expenses, costs thereon, within 60 days from the date of receipt of the said Notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of Act read with rule 8 of the security interest Enforcement Rules 2002 on this 26th day of May of the year 2022.

The borrower in particular and the public in general is hereby cautioned not to dea with the property and any dealings with the property will be subject to the charge of the IDBI Bank Limited (IDBI), Siddhanath Road Branch, Vadodara for an amount Rs. 4.68.012.12 (Rupees Four Lakh Sixty Eight Thousand Twelve & paisa twelve Only) with further interest from mentioned in the notice and incidental expenses, costs thereon. (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has been given effect)

"The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

Description of the Immovable Property

All that part and parcel of being immovable Residential property situated at "A-1 305, Ashwamegh III, Samrajya, Akota, Vadodara - 390020 in the Registration District Sub Registration District Vadodara in the State of Gujarat together with all and singular the structures and erections thereon, both present and future. Bounded: East: FLAT No. A1-306, West: Margin and road, South: OTS, North: Margin and Road together with all and singular the structures and erections thereon, both present and future

Sd/ Authorised Officer, IDBI Bank Ltd.

(1) IDBI BANK

IDBI Bank Limited: Siddhanath Road Branch Shagyoday House, Siddhanath Road, Opp.Krishna Talkies

Appendix-IV[Rule-8(1)] - POSSESSION NOTICE - (For Immovable Property Whereas, The undersigned being the authorized officer of the IDBI Bank Limited (IDBI). Siddhanath Road Branch, Vadodara, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 29-11-2021 calling upon the borrower M/s. A & J Infratrade Private Limited, Shri Narhar Ramchandra Argade and Shri Vijaykumar Ganeshrao Joshi to repay the amount mentioned in the notice being Rs. 40,55,504.76 (Rupees Forty Lakh Fifty Five Thousand Five Hundred Four & Paisa Seventy-Six Only) with further interest from mentioned in the notice and incidental expenses, costs thereon, within 60 days from the date of receipt of the said Notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic **Possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of Act read with rule 8 of the security interest Enforcement Rules 2002 on this 26th day of May of the year 2022.

The borrower in particular and the public in general is hereby cautioned not to dea with the property and any dealings with the property will be subject to the charge of the IDBI Bank Limited (IDBI), Siddhanath Road Branch, Vadodara for an amount Rs. 40,55,504.76 (Rupees Forty Lakh Fifty Five Thousand Five Hundred Four & Paisa Seventy-Six Only) with further interest from mentioned in the notice and incidental expenses, costs thereon. (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has been given effect)

"The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.'

Description of the Immovable Property

Property No. 1: All that piece and parcel of Residential Flat at "Samta Co Op Society Ltd", Building Typa -A, Block No. 5, Flat No. 52, Subhanpura, Vadodara ring 1030 00 Sq. Ets situated in Subhannu of Land Bearing Survey No. 146, 148, 150 to 154, C. S. No. 3706 in the Registration District Sub Registration District Vadodara in the State of Gujarat together with all and singular the structures and erections thereon, both presen and future. Bounded: East: 9 Mtr Road, West: Building Type-A, Block No. 4, Flat No. 37, South: 9 Mtr Road, North: Parking area of Block No. 5.

Property No. 2: All that piece and parcel of immovable properties being residential block no. C/3, Athar Co-Op Housing Society, admeasuring about 537 Sq. Fts plot area with 380 Sq. Fts construction on it having R S No. 879, City Survey No. 1176 to 1187, F. P. No. 418-389, T.P. No. 3 of Village Bapod Waghodiya Road, B/h Rajiv Gandhi Swimming Pool, Off Nalanda Water Tank Road in the Registration District Sub Registration District Vadodara in the State of Gujarat together with all and singular the structures and erections thereon, both present and future. Bounded: East: 6 Mtr Road and Megha Society, West: Plot No. C/1 and Open Plot, South: Plot No. C/4, North: Plot No. C/44.

Date: 26.05.2022- Place: Vadodara Sd/ Authorised Officer, IDBI Bank Ltd.

OMKAR OVERSEAS LTD.

Registered Office: 212, New Cloth Market, O/s. Raipur Gate, Raipur, Ahmedabad - 380002 Ph. No.: 91-79-22132078 CIN: L51909GJ1994PLC023680 **EXTRACT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS** FOR QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2022

No Particulars ended on ended on 3	rresponding months
	nded in the evious year
] 31	1/03/2021 Audited)
1 Total Income from Operations 15.89 103.12 Net Profit / (Loss) for the period	0.00
(before Tax, Exceptional and / or Extraordinary items) (377.28) (375.91) 3 Net Profit / (Loss) for the period	(3.60)
before tax (after Exceptional and / or Extraordinary items) (377.28) (375.91)	(3.60)
4 Net Profit / (loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items) (377.02) (375.99)	(3.55)
5 Total Comprehensive Income for the period (Comprising Profit/ (loss) for the period (after tax)	, ,
and other comprehensive income (377.02) (375.99) (after tax)	(3.55)
6 Paid-up equity Share Capital 492.36 492.36 7 Reserves (excluding Revaluation	492.36
Reserve) as shown in the Audited Balance Sheet of the previous year (384.56)	-
8 Earnings per Share (of Rs.10/- each) (for continuing operations)	(0.074)
(a) Basic (7.540) (7.52) (b) Diluted (7.540) (7.52)	(0.071) (0.071)

Notes: (1) The above is an extract of the detailed format of quarter and year ended Audited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure R equirements) Regulations, 2015. The Full forma of the Audited Financial Results is available on the stock Exchange website www.bseinida.com & on company's website - www.omkaroverseasltd.com (2) The above financial results have been reviewed by the Audit Committee ar approved by the Board of Directors in the meeting held on 30th May, 2022.

The company has adopted Indian Accounting Standard ("IND AS") notified he Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Result for the Quarter and year ended on 31st March, 2022 in accor with IND-AS and other accounting principles generally accepted in India.

Place: Ahmedabad For, Omkar Overseas Limited Ramesh Deora, Director & CEO DIN: 001135440 Date: 30/05/2022





એલેમ્બિક લિમિટેડ

CIN: L26100GJ1907PLC000033 ૨જીસ્ટર્ક ઓફિસ : એલેબ્લિક રોક, વકોદરા – ૩૯૦ ૦૦૩ ફોન: +૯૧ ૨૬૫ ૨૨૮૦૫૫૦ વેબસાઈટ: www.alembiclimited.com ઈ-મેલ: alembic.investors@alembic.co.in

નોટીસ (કંપનીના ઇક્વિટી શેર્સ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) માં તબદિલ કરવા બાબત)

આ નોટીસ ઇન્વેસ્ટર એજયુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરીટી (એકાઉન્ટીંગ, ઓડીટ, ટ્રાન્સફર એન્ડ રીફંડ) રૂલ્સ, ૨૦૧૬ અન્વચે પ્રકાશિત કરવામાં આવી છે. આ નિયમોમાં, અન્ય બાબતો ઉપરાંત, એવા બધા જ શેર્સ જેના ઉપર સતત સાત વર્ષો સુધી ડીવીડન્ડ ચૂકવાચું નથી કે શેરધારક દ્વારા માંગણી કરાઇ નથી તે ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF)નાં ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવાની જોગવાઇ છે.

નિયમોમાં નિર્ધારિત વિવિધ આવશ્યકતાઓનું પાલન કરતા, કંપનીએ જેમના શેર આ નિયમો અન્વયે IEPF ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવા પાત્ર થાય છે તે લાગતા વળગતા બધા જ શેરધારકોને વ્યક્તિગત રીતે ચોગ્ય કાર્ચવાહી કરવા જાણ કરી છે.

કંપનીએ આવા શેરધારકોની વિગતો જેવી કે નામ અને ફોલીઓ નંબર/ ડીપી આઇડી, ક્લાયન્ટ આઇડી નીચે દર્શાવેલ વેબલીંક ઉપર મુકેલ છેઃ https://www.alembiclimited.com/#iepf

દરેક નાણાંકીય વર્ષમાં માંગણી નહીં કરાયેલ ડીવીડન્ડની વિગતો નીચે દર્શાવેલ વેબલીંક પર ઉપલબ્ધ છે:

https://www.alembiclimited.com/#dud

શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ વિગતોને ચકાશે અને તેમના માંગણી નહી કરાયેલ ડિવિડન્ડનો દાવો તરત જ કરે.

જેમના શેર્સ IEPF ડીમેટ ખાતામાં ટ્રાન્સફર થવા પાત્ર છે તેવા શેરધારકોએ નોંધ લેવી કે તેમના શેર્સ ફીઝીકલ કે ઇલેકટ્રોનિક ફોર્મમાં, નિયમોમાં આપેલ કાર્યપદ્ધતિ પ્રમાણે IEPF ડીમેટખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ફીઝીકલ ફોર્મમાં શેર્સ ધરાવતા શેરધારકોના સંદર્ભમાં, IEPF ના ડીમેટ ખાતામાં શેર્સના સ્થાનાંતરણ પછી, તેમના નામ પર નોંધાયેલા મૂળ શેર સર્ટીફીકેટો આપોઆપ રદ થઇ જશે અને બિન વાટાધાટપાત્ર (નોન - નેગોશીચેબલ) માનવામાં આવશે. ડીમેટ ફોર્મમાં શેર્સ ધરાવતા શેરધારકોના સંદર્ભમાં, કંપની તેમના ખાતામાં રહેલા શેર્સ ને IEPF ડીમેટ ખાતાની તરફેણમાં ટ્રાન્સફર કરવા માટે કોર્પોરેટ એક્શન દ્વારા સંબંધિત ડિપોઝિટરી ને જાણ

શેરધારકોએ વધુમાં નોંધ લેવી કે કંપનીએ પોતાની વેબસાઇટ ઉપર મુકેલી વિગતો કંપની દ્વારા આ નિયમો અનુસાર નવા શેર સર્ટિફિકેટ જારી કરવા અને IEPF ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવા માટે પૂરતી નોટિસ તરીકે ગણાશે. જો ૩૧મી ઓગષ્ટ, ૨૦૨૨ અથવા કંપની દ્વારા લંબાવવામાં આવેલી અન્ય તારીખ સુધીમાં સંબંધિત શેર ધારકો તરફથી કોઇ સુચના પ્રાપ્ત નહીં થાય તો નિચમોમાં કરાચેલી જોગવાઈના અનુપાલનમાં આ શેર્સ નિચત તારીખે તે નિચમોમાં આપેલી કાર્ચપધ્ધતિ પ્રમાણે કંપનીના કોઇપણ પ્રકારની આગળની કાર્ચવાહી અથવા જવાબદારી વગર IEPF ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

શેરધારકોએ વધુમાં નોંધ લેવી કે IEPF માં ટ્રાન્સફર થચેલા, ન ચુકવાચેલા ડીવીડન્ડ અને શેર્સ અને તેમની ઉપર મળી શકતા બધા લાભો, જો કોઇ હોય તો, સહીત નિયમ પ્રમાણેની કાર્યપદ્ધતિ મુજબ IEPF ઓથોરીટી પાસેથી વેબ ફોર્મ IEPF-5 ભરીને પરત મેળવી શકશે.

જો શેરધારકોને આ વિષયમાં કે નિયમો અંગે કોઇ પ્રશ્ન હોય તો તેઓ કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ્સ લીંક ઇન ટાઇમ ઇન્ડીયા પ્રા. લી. બી-૧૦૨-૧૦૩ શાંગ્રીલા કોમ્પ્લેક્સ, ૧લા માળે, રાધાકૃષ્ણ ચાર રસ્તા પાસે, અકોટા, વડોદરા - ૩૯૦ ૦૨૦. ફોન નં. +૯૧ ૨૬૫ ૨૩૫૬૫૭૩, ૬૧૩૬૦૦૦, ઇ-મેલ: vadodara@linkintime.co.in નો સંપર્ક કરે.

એલેમ્બિક લિમિટેડ વતી,

સ્થળઃ વડોદરા તારીખઃ ૩૦મી મે. ૨૦૨૨ દ્રિગેશ મિત્તલ કંપની સેક્રેટરી

આ નોટીસ કંપનીની વેબસાઇટ www.alembiclimited.com ઉપર ઇનવેસ્ટર સેક્શનમાં અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.nseindia.com અને www.bseindia.com ઉપર કોર્પોરેટ એનાઉન્સમેન્ટ સેક્શનમાં પણ ઉપલબ્ધ છે.

પૌષક લિમિટેડ

CIN: L51909GJ1972PLC044638 **૨૪)સ્ટર્ડ ઓફિસઃ** એલેમ્બિક રોડ, વડોદરા-૩૯૦૦૦૩ डोनः +८१ २९४ २२८०४४० E-mail: investors@paushak.com | Website: www.paushak.com

નોટીસ (કંપનીના ઇક્વિટી શેર્સ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) માં તબદિલ કરવા બાબત)

આ નોટીસ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરીટી (એકાઉન્ટીંગ, ઓડીટ, ટ્રાન્સફર એન્ડ રીફંડ) રૂલ્સ, ૨૦૧૬ અન્વચે પ્રકાશિત કરવામાં આવી છે. આ નિયમોમાં, અન્ય બાબતો ઉપરાંત, એવા બધા જ શેર્સ જેના ઉપર સતત સાત વર્ષો સુધી ડીવીડન્ડ ચૂકવાયું નથી કે શેરધારક દ્વારા માંગણી કરાઇ નથી તે ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF)નાં ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવાની જોગવાઇ છે.

નિયમોમાં નિર્ધારિત વિવિધ આવશ્યકતાઓનું પાલન કરતા, કંપનીએ જેમના શેર આ નિયમો અન્વયે IEPF ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવા પાત્ર થાય છે તે લાગતા વળગતા બધા જ શેરધારકોને વ્યક્તિગત રીતે ચોગ્ય કાર્ચવાહી કરવા જાણ કરી છે.

કંપનીએ આવા શેરધારકોની વિગતો જેવી કે નામ અને ફોલીઓ નંબર/ ડીપી આઇડી, ક્લાયન્ટ આઇડી નીચે દર્શાવેલ વેબલીંક ઉપર મુકેલ છેઃ

https://www.paushak.com/IEPF.aspx દરેક નાણાંકીય પર્યમાં માંગણી નહી કરાયેલ ડીવીડન્ડની વિગતો નીચે દર્શાવેલ વેબલીંક પર ઉપલબ્ધ છે:

https://www.paushak.com/unpaid-or-unclaimed-dividend.aspx શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ વિગતોને ચકાશે અને તેમના

માંગણી નહી કરાયેલ ડિવિડન્ડનો દાવો તરત જ કરે.

જેમના શેર્સ IEPF ડીમેટ ખાતામાં ટ્રાન્સફર થવા પાત્ર છે તેવા શેરધારકોએ નોંધ લેવી કે તેમના શેર્સ ફીઝીકલ કે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં, નિયમોમાં આપેલ કાર્ચપદ્ધતિ પ્રમાણે IEPF ડીમેટખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ફીઝીકલ ફોર્મમાં શેર્સ ધરાવતા શેરધારકોના સંદર્ભમાં, IEPF ના ડીમેટ ખાતામાં શેર્સના સ્થાનાંતરણ પછી, તેમૂના નામ પર નોંધાયેલા મૂળ શેર સર્ટીફીકેટો આપોઆપ રદ થઇ જશે અને બિન વાટાધાટપાત્ર (નોન - નેગોશીયેબલ) માનવામાં આવશે. ડીમેટ ફોર્મમાં શેર્સ ધરાવતા શેરધારકોના સંદર્ભમાં, કંપની તેમના ખાતામાં રહેલા શેર્સ ને IEPF ડીમેટ ખાતાની તરફેણમાં ટ્રાન્સફર કરવા માટે કોર્પોરેટ એક્શન દ્વારા સંબંધિત ડિપોઝિટરી ને જાણ

શેરધારકોએ વધુમાં નોંધ લેવી કે કંપનીએ પોતાની વેબસાઇટ ઉપર મુકેલી વિગતો કંપની દ્વારા આ નિયમો અનુસાર નવા શેર સર્ટિફિકેટ જારી કરવા અને IEPF ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવા માટે પૂરતી નોટિસ તરીકે ગણાશે. જો ૩૧મી ઓગષ્ટ, ૨૦૨૨ અથવા કંપની દ્વારા લંબાવવામાં આવેલી અન્ય તારીખ સુધીમાં સંબંધિત શેર ધારકો તરફથી કોઇ સુચના પ્રાપ્ત નહીં થાય તો નિયમોમાં કરાચેલી જોગવાઇના અનુપાલનમાં આ શેર્સ નિયત તારીખે તે નિચમોમાં આપેલી કાર્ચપધ્ધતિ પ્રમાણે કંપનીના કોઇપણ પ્રકારની આગળની કાર્ચવાહી અથવા જવાબદારી વગર IEPF ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં

શેરધારકોએ વધુમાં નોંધ લેવી કે IEPF માં ટ્રાન્સફર થચેલા, ન ચુકવાચેલા ડીવીડન્ડ અને શેર્સ અને તેમની ઉપર મળી શકતા બધા લાભો, જો કોઇ હોય તો, સહીત નિચમ પ્રમાણેની કાર્યપદ્ધતિ મુજબ IEPF ઓથોરીટી પાસેથી વેબ ફોર્મ IEPF-5 ભરીને પરત મેળવી શકશે.

જો શેરધારકોને આ વિષયમાં કે નિયમો અંગે કોઇ પ્રશ્ન હોય તો તેઓ કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ્સ લીંક ઇન ટાઇમ ઇન્ડીયા પ્રા. લી. બી-૧૦૨-૧૦૩ શાંગ્રીલા કોમ્પ્લેક્સ, ૧લા માળે, રાધાકૃષ્ણ ચાર રસ્તા પાસે, અકોટા, વડોદરા - ૩૯૦ ૦૨૦. ફોન નં. +૯૧ ૨૬૫ ૨૩૫૬૫૭૩, ક૧૩૬૦૦૦, ઇ-મેલ: vadodara@linkintime.co.in નો સંપર્ક કરે.

પીષક લિમિટેક વતી,

મનીષા સરાફ સ્થળઃ વડોદરા તારીખઃ ૩૦મી મે, ૨૦૨૨ કંપની સેક્રેટરી

આ નોટીસ કંપનીની વેબસાઇટ www.paushak.com ઉપર ઇનવેસ્ટર સેક્શનમાં અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com ઉપર કોર્પોરેટ એનાઉન્સમેન્ટ સેક્શનમાં પણ ઉપલબ્ધ છે.

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE OUARTER AND YEAR ENDED MARCH 31, 2022

(< III Lakiis)					
Sr. No	PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED	
		31.03.2022	31.03.2021	31.03.2022	31.03.2021
		(Audited)	(Audited)	(Audited)	(Audited)
1	Total Income from Operations (net)	1609.45	1946.84	5837.04	4881.51
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	9.22	92.09	58.37	288.10
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	9.22	92.09	58.37	288.10
4	Net Profit / (Loss) for the period after tax (after- Exceptional and/or Entraordinary items)	8.44	94.41	40.91	206.43
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	8.44	94.41	40.91	206.43
6	Equity Share Capital	150.00	150.00	150.00	150.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	1	2366.17	2325.26
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)				
	1. Basic	0.56	6.29	2.73	13.76
	2. Diluted	0.56	6.29	2.73	13.76
NOTE :-					

The above is an extract of the detailed format of Audited Financial Results for the guarter & year ended 31st March, 2022, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results are available on the website of the Stock Exchange(s). BSE: www.bseindia.com and the Company' vebsite:www.betexindia.com

For, BETEX INDIA LIMITED PLACE : SURAT Manish Somani WHOLETIME DIRECTOR DATE : 30/05/2022 CIN: L17119GJ1992PLC018073

436, GIDC, Pandesara, Surat-394221, Gujarat, INDIA.

Ph.: (91-261) 2898595, FAX: (91-261) 2334189, E-mail: corporate@betexindia.com

torrent-PHARMA

CIN: L24230GJ1972PLC002126 વેબસાઈટઃ www.torrentpharma.com ย์भेย์ด: investorservices@torrentpharma.com

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ

૨જીસ્ટર્ડ ઓફિસ: ટોરેન્ટ હાઉસ, ઓફ આશ્રમ રોડ, અમદાવાદ — ૩૮૦ ૦૦૯, ગુજરાત, ઇન્ડીયા झोनः + eq ७e २६५eeoo ફેક્સઃ + ૯૧ ૭૯ ૨૬૫૮૨૧૦૦

नोटीस

આ नोટીસ કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ("એક્ટ") ની કલમ ૧૨૪ (६) ને ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (એકાઉન્ટીંગ, ઓડિટ, ટ્રાન્સફર એન્ડ રીફંડ) રૂલ્સ, ૨૦૧૬, ("રૂલ્સ") માં વખતોવખત કરાચેલા સુધારા સાથે વંચાણે લીધા મુજબ પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે. તે કંપનીના ઈક્વિટી શેર્સ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ("આઈઈપીએફ") ઓથોરિટીના ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા સંબંધી છે. આ શેર્સ એવા શેરહોલ્ડર્સના છે જેમણે સતત છેલ્લા સાત વર્ષ અથવા તેથી વધુના સમયગાળા માટે પોતાનું ડિવિડન્ડ ક્લેઇમ કર્યું નથી .

કંપનીએ સંબંધિત શેરહોલ્ડર્સને કંપની પાસે નોંધાયેલા હોય તેવા તેમના સરનામે એ મતલબનો સ્પષ્ટ પત્ર પણ મોકત્યો છે, જેમાં આઈઈપીએફને ટ્રાન્સફર કરવામાં આવી રહેલા તેમના શેર્સની વિગતો આપવામાં આવી છે. વધુમાં, સંબંધિત શેરહોલ્ડર્સના નામ, તેમના ફોલિયો નં. અથવા ડીપી આઈડી - ક્લાયન્ટ આઈડી કંપનીની વેબસાઈટ : www.torrentpharma.com ઉપર ઉપલબ્ધ છે .

સંબંધિત શેરહોલ્ડર્સને વિનંતી કરવામાં આવે છે કે , તેમણે ક્લેઇમ નહીં કરેલા ડિવિડન્ડનો ક્લેઇમ તેઓ તુરત જ એક અરજી કરીને, તેની સાથે પત્રમાં ઉલ્લેખિત જરૂરી દસ્તાવેજો રજૂ કરી કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ્સ કેફિન ટેકનોલોજીસ લિ.("કેફિનટેક") ને નીચે દર્શાવેલા સંચનામે મોકલી આપે:

> કેફિન ટેકનોલોજીસ લિ. સેલેનિયમ ટાવર બી, પ્લોટ નં. ૩૧-૩૨, ગચીબાવલી, ફાયનાન્સિયલ ડિસ્ટ્રિક્ટ, નાનકરામગુડા, હૈદ્રાબાદ-૫૦૦ ૦૩૨ **ફोनः ०४०-५७**९५९५८५; ईड्स नं.: ०४०-२३००१९५३ **ย์มิย์ต:** einward.ris@Kfintech.com **วัดเลเย์ะ:** www.Kfintech.com

સંબંધિત શેરહોલ્ડર્સને એવી પણ વિનંતી કરવામાં આવે છે કે, શેર્સના ટ્રાન્સર્ફ્સ અથવા તો ડિવિડન્ડની ચૂકવણી વગેરે સામે કોઈ મનાઈહુકમ/નિયંત્રણ આદેશો વગેરે કોઈ કોર્ટ/વેદ્યાનિક સત્તા પાસેથી મેળવવામાં આવ્યા હોય તો તेनी એક નકલ સાથે કંપનીને તે બાબતે તાત્કાલિક જાણ કરવામાં આવે.

જો કંપનીને સંબંધિત શેરહોલ્ડર્સ પાસેથી ૧લી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં ઉપર દર્શાવ્યા મુજબના, સંપૂર્ણ વિગતો સાથેના ડોક્યુમેન્ટ્સ નહીં મળે તો, કંપની ક્લેઇમ નહીં કરેલા ડિવિડન્ડ તથા શેર્સ નિયુક્ત તારીખ સુધી નિયત કરાયેલા પ્રોસિજર્સ પ્રમાણ આઈઈપીએફમાં ટ્રાન્સફર કરી રૂલ્સમાં આપેલી નિર્દિષ્ટ આવશ્યકતાઓનું પાલન કરશે આ રૂલ્સ અનુસાર આઈઈપીએફ ઓથોરિટીને ટ્રાન્સફર કરાયેલા, ડિવિડન્ડ અને શેર્સ બાબતે કંપની સામે કોઈ દાવો માન્ય રહેશે નહીં .

સંબંધિત શેરહોલ્ડર્સ ફૃપયા એ વાતની પણ નોંધ લે કે, આ રીતે ટ્રાન્સફર થયેલા શેર્સ અને તેના ઉપરનું ડિવિડન્ડ પણ તેઓ આઈઈપીએફ પાસેથી પરત મેળવવા માટેનો દાવો કરી શકે છે. તેમ કરવા માટેની વિગર્તો કંપનીની વેબસાઈટ: www.torrentpharma.com તથા કોર્પોરેટ અર્ફર્સ મંત્રાલચની વેબસાઈટ http://iepf.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે.

વધુ માહિતી માટે, સંબંધિત શેરહોલ્ડર્સ કેફિનટેકનો અથવા તો કંપનીના સેક્રેટેરિયલ વિભાગનો ઉપર દર્શાવ્ય મુજબના સરનામે સંપર્ક કરી શકે છે.

સ્થળઃ અમદાવાદ તારીખઃ ૩૦ મે, ૨૦૨૨

સ્થળઃ ગાંધીનગર

તારીખઃ ૩૧/૦૫/૨૦૨૨

વીપી (લીગલ) અને કંપની સેક્રેટરી

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ વતી

મહેશ અગ્રવાલ

다 대 교육 INDUSTRIES LIMITED

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31/03/2022

(₹ in Lakh) **Particulars QUARTER ENDED** YEAR ENDED 31/03/2022 31/03/2021 31/03/2022 31/03/2021 Audited Audited Audited Audited 1 Total Income from operations (net) **28591.61** 23318.52 **91450.32** 57676.98 Net Profit / (Loss) for the period before Tax and -1205.66 -1357.24 725.46 -266.30 Exceptional items Net Profit / (Loss) for the period before tax 1360.79 -1205.85 725.27 -269.85 after Exceptional items 4 Net Profit / (Loss) for the period after tax and -789.88 1223.58 301.06 -707.54 **Exceptional items** Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) -761.57 1177.12 330.99 -661.68 and Other Comprehensive Income (after tax)] **10364.24** 10364.24 **10364.24** 10364.24 6 Paid up Equity Share Capital Other Equity excluding Revaluation Reserves Earnings Per Share (of Rs. 10/- each not annualised (for continuing and discontinued operations) -0.73 1.14 0.32 -0.64 2. Diluted

1. The above is an extract of the detailed format of Audited Financial Results for the quarter and year ended March 31, 2022, filed with the Stock Exchange(s) under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the website of the Stock Exchange(s) BSE: www.bseindia.com and NSE. www.nseindia.com and website of the Company: www.sumeetindustries.com.

For and on behalf of the Board of Director PLACE: Surat Sumeet Shankarlal Somani Managing Director DATE : 30/05/2022

CIN No. L45200GJ1988PLC011049 Regd. Office: 504, Trividh Chambers, Opp. Fire Station, Ring Road, Surat - 395 002. India. E-mail: corporate@sumeetindustries.com, Visit us at: www.sumeetindustries.com

DRC ડીઆરસી સિસ્ટમ્સ ઇન્ડિયા લીમીટેડ SYSTEMS [CIN: L72900GJ2012PLC070106]

૨૪૩૨૮ ઓફીસ : ૨૪મો માળ, ગીફ્ટ ટુ બિલ્ડીંગ, બ્લોક નં. ૫૬, રોડ-૫ સી, ઝોન-૫, ગિફ્ટ સિટી, ગાંધીનગર, તાલુકો અને જિલો – ગાંધીનગર–૩૮૨ ૩૫૫

ફોન : +૯૧ ૭૯ ૬૭૭૭૨૨૨૨ **ઇમેઇલ** : <u>ir@drcsystems.com</u> **વેબસાઇટ** : <u>www.drcsystems.com</u>

વિડિયો કોન્ફરન્સીંગ (વીસી) / અન્ય ઓડિયો – વિઝયુઅલ માધ્યમો (ઓએવીએમ) દ્વારા ચોજાનાર કંપનીની ૧૦મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

બાથી નોટીસ આપવામાં આવે છે કે ડીઆરસી સિસ્ટમ્સ ઇન્ડિયા લીમીટેડ (કંપની) ના સભ્યોની ૧૦મી વાર્ષિક સામાન્ય સભા '''એજીએમ'')બુધવાર, ૨૯ જુન, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વિડિયો કોન્ફરન્સીંગ (વીસી)/અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) દ્વારા એજીએમની નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલ ૪નરલ પરિપત્ર નં. ૨૦/૨૦૨૦ તારીખ ૫ મે, ૨૦૨૦ સાથે વંચાતા જનરલ પરિપત્ર નં. ૨૧/૨૦૨૧ તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ અને અન્ય સંબંધિત પરિપત્રો અને સિક્યોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ સંબંધિત પરિપત્રો (અહી પછી પરિપત્રો તરીકે દર્શાવેલ છે)અને અન્ય તમામ લાગુ કાયદાઓ અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (એમસીએ)અને સિક્યોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી) દ્વારા જારી કરાયેલ પરિપત્રોની જોગવાઇઓના અનુપાલન હેઠળ બોલાવામાં આવી

ઉપરોક્ત પરિપત્રોના અનુસંધાનમાં, એજીએમની નોટીસ તેમજ વાર્ષિક અહેવાાલ ૨૦૨૧-૨૨, જે સભ્યોના ઇમેઇલ એડ્રેસ કંપની/ડિપોજીટરીઓ પાસે રજીસ્ટર્ડ છે તેમને ફક્ત ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવશે સિવાય કે કોઇ સભ્યે કંપનીને ir@drcsystems.com ઉપર લેખીતમાં તેની ફીઝીકલ નકલ માટે અરજી કરી હોય. સભ્યોએ નોંઘ લેવી કે એજીએમની નોટીસ અને વાર્ષિક અહેવાલ ૨૦૨૧–૨૨ કંપનીની વેબસાઇટ <u>www.drcsystems.com</u> અને સ્ટોક એક્સચેન્જો એટલે કે બીએસઇ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડની વેબસાઇટ અનુક્રમે <u>www.bseindia.com</u> અને <u>www.nseindia.com</u> અને લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ (લિંક ઇનટાઇમ) ની વેબસાઇટ http://instavote.linkintime.co.in પર ઉપલબ્ધ કરાવામાં આવશે. સભ્યો ફક્ત વીસી / ઓએવીએમ દ્વારા એજીએમમાં હાજરી આપી શકે છે અને ભાગ લઇ શકે છે. એજીએમમાં જોડાવા માટેની સુચનાઓ એજીએમની નોટીસમાં આપવામાં આવશે. વીસી ઓએવીએમ દ્વારા ભાગ લેનાર સભ્યોની કંપની કાયદા, ૨૦૧૩ ની કલમ ૧૦૩ મુજબ એજીએમ માટે કોરમની ગણતરી માટે ધ્યાનમાં

કંપની તેના તમામ સભ્યોને એજીએમની નોટીસમાં જણાવેલ તમામ ઠરાવો પર તેમના મત આપવા માટે રીમોટ ઇ-વોટીંગની સવલત આપી રહી છે. વધુમાં, કંપની એજીએમ દરમિયાન ઇ-વોટીંગ દ્વારા મતદાનની સવલત પણ પુરી પાડી રહી છે. રીમોટ ઇ-વોટીંગ / ડ-વોટીંગ માટેની વિગતવાર પ્રક્રિયા એજીએમની નોટીસમાં આપવામાં આવશે. જે સભ્યોના ઇમેઇલ એડ્રેસ કંપની / આરટીએ / ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ(ટો)(ડીપી) પાસે ૨જીસ્ટ૨ / સુધારો કરાવ્યા નથી, તેઓને

કંપનીની એજીએમની નોટીસ અને ઇ-વોટીંગની લોગીન વિગતો મેળવવા માટે ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર કરવા માટે નીચેની પ્રક્રિયા એ) ફિઝિકલ સ્વરૂપે શેર ધરાવતા સભ્યો માટે : <u>ir@drcsystems.com</u> પર ઇમેઇલ કરીને આવશ્યક વિગતો જેવી કે

ફ્રોલિયો નંબર, શેરહોલ્ડરનું નામ જણાવવા વિનંતી છે અથવા ઇ-કોમ્યુનિકેશન રજીસ્ટ્રેશન ફોર્મ, જે કંપની વેબસાઇટ www.drcsystems.com પર ઉપલબ્ધ છે, તે ભરી કંપનીને ઇમેઇલ કરવા વિનંતી છે. બી) ડીમેટ સ્વરૂપે શેરો ધરાવતા સભ્યો તેમના લાગતા વળગતા ડિપોઝીટરી પાર્ટીશીપન્ટનો સંપર્ક કરીને તેમના ઇમેઇલ આઇડી

રજીસ્ટર કરાવી શકે છે.

કંપનીની એજીએમની નોટીસ કટ-ઓફ તારીખના રોજ શેર ધરાવતા જે તે સભ્યોને તેમના રજીસ્ટર્ડ ઇમેઇલ આઇડી પર લાગુ કાયદાઓ મુજબ નિયત સમયે મોકલવામાં આવશે.

ડીઆરસી સિસ્ટમ્સ ઇન્ડિયા લીમીટેડ વતી,

જૈનમ શાહ

કંપની સેક્રેટરી

સ્થળ : ગાંદીનગર તારીખ : ૩૦ મે, ૨૦૨૨

Bandhan રાજનલ ઑફિસઃ નેતાજી માર્ગ, મીઠાખળી છ રસ્તા પાસે, એલિસબ્રિજ, અમદાવાદ–૩૮૦ ૦૦૬. ફોનઃ ૨૬૪૨૧૬७૧–७૫

બાકીદારો માટે માંગણાની નોટિસ

નીચે જણાવેલ ખાતું એન.પી.એ. માં પરિવર્તિત થયેલ છે અને બંધન બેંક દ્વારા સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ (ધ એક્ટ), ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) हેઠળ નીચે જણાવેલ કર્જદારોને કિમાન્ક નોટિસ જારી કરવામાં આવેલ હતી જે પરત ફરી છે. આથી આપ તમામને અને જાહેર જનતાને મોટા પ્રમાણમાં આ પ્રકાશન દ્વારા નોટિસ જારી કરવામાં આવે છે.

લોન લેનારનું નામ, અને લોન	મોર્ગેજ કરેલ મિલકતનું વર્ણન (સિક્ચોર્ડ એસેટ)	કિમાન્ડ નોટિસ ની	કિમાન્ડ નોટિસની તારીખે	નોટિસ લગાવ્યાની
ખાતા નં.		તારીખ/NPA તારીખ	બાકી રહેતી રકમ (રૂા.માં)	તારીખ
શ્રી નયનુકુમાર વદ્યભભાઈ	બધી જ ચલ અને અચલ સ્થાવર સંપત્તિ આશરે ૬७.૩૩ ચોરસ મીટર છે, જે સરવે નંબર ૬૯७/૩ પૈકી	૧૧.૫.૨૦૨૨/	રૂ.૧૧,૫૮,૦૫૬.૯૦	૨૧.૦૫.૨૦૨૨
દેવડીયા	ફાઇનલ પ્લોટ નંબર, સરવે ૬૯७/૩, બ્લોક/બિલ્કિંગ નંબર બી, મકાન નંબર ૫૦૨, ફ્લૉરઃ પમો માળ,	૦૯.૦૫.૨૦૨૨		
શ્રીમતી हેતલબેન ગોકલભાઈ	મકાન/સોસાયટીનું નામઃ સત્વશારદા–૧; શૅલ્બી હૉસ્પિટલ પાસે, નરોડા–નિકોલ રોડ, અમદાવાદ,			
નયના	શહેર/તાલુકોઃ અમદાવાદ શહેર, ગુજરાત, પિન કોડ–૩૮૨૪૩૦ સ્થિત છે અને તેની ચતુર્દિશા			
૧૧૧/૧૬૬૨	નિમ્નલિખિત છેઃ ઉત્તર ઃ ફ્લેટ નંબર બી–૫૦૫, પૂર્વઃ ફ્લેટ નંબર બી–૫૦૧, પશ્ચિમઃ ફ્લેટ નંબર બી–			
	૫૦૩, દક્ષિણઃ સોસાયટી કોમન પ્લોટ			

આ નોટિસ દ્વારા બેંક તમને પુનઃ ચૂકવણી કરવાની માંગણી કરે છે જે પુનઃ ચૂકવણી તમારા નામે રહેલી બાકી રકમ, વ્યાજ, ખર્ચ અને શુલ્ક સહિત આ નોટિસની તારીખથી ૬૦ દિવસમાં ભરવાની રહેશે, જેમાં તમે નિષ્ફળ રહેશો તો બેંક સરફેસી (SARFAESI) કાયદાની કલમ ૧૩(૪) અન્વયે ઉદ્વેખિત કોઈ અથવા તમામ પ્રકારનાં પગલાં આગળના સમયમાં લઈ શકે છે. સિક્યોર્ડ એસેટને રીડીમ કરવા/પરત મેળવવા ઉપલબ્ધ સમય સંદર્ભે એક્ટની કલમ ૧૩ની પેટા–કલમ (૮)ની જોગવાઈઓ તરફ કર્જદાર/મોર્ગેજ મૂકનારનું ધ્યાન દોરવામાં આવે છે.

અધિકૃત અધિકારી સ્થળઃ અમદાવાદ તારીખઃ ૩૧/૦૫/૨૦૨૨ બંધન બેંક લિમિટેડ



Bandhan રીજનલ ઑફિસઃ નેતાજી માર્ગ, મીઠાખળી છ રસ્તા પાસે, એલિસબ્રિજ, અમદાવાદ-ક. ફોનઃ ૯૧-७૯-૨૬૪૨૧૬७૧ એલિસબ્રિજ, અમદાવાદ-૬. ફોનઃ ૯૧-७૯-૨૬૪૨૧૬७૧-७૫

સાંકેતિક કબજા અંગેની નોટિસ

ધ સિક્યુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઑફ ફાઈનિન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યુરિટી ઈન્ટરેસ્ટ એકટ, ૨૦૦૨ની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલી સત્તાઓ, કે જેનો અર્થ ધ સિક્યુરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના નિયમ ૩ માં આપવામાં આવ્યો છે, તે સત્તાઓનો ઉપયોગ કરતાં નોટિસ આપવામાં આવે છે કે, અધિકૃત અધિકારીએ, અહીં જણાવેલાં ખાતાંનાં દેવાદારોને ડિમાન્ડ નોટિસ પાઠવી હતી અને તેમાં તે નોટિસ મબ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર, રકમ ભરપાઈ કરી દેવા માટે જણાવ્યું હતું. દેવાદાર આ રકમ ભરવામાં નિષ્ફળ ગયા હોવાથી, દેવાદાર અને જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે, નીચે સહી કરનાર વ્યક્તિએ,ઉપરોક્ત ધારાની કલમ ૧૩ની પેટા કલમ (૪) જેનો અર્થ ઉપરોક્ત ધારામાં નિયમ ૮ માં આપવામાં આવ્યો છે—તે મુજબ તે વ્યક્તિ (નીચે સફી કરનાર) ને મળેલી સત્તાનો ઉપયોગ કરીને, તેણે અર્ફી નીચે જે મિલકતન્ વર્ણન આપવામાં આવ્યું છે, તે મિલકતનો સાંકેતિક ક્બજો લઈ લીધો છે. આથી, ખાસ કરીને દેવાદાર અને જાહેર જનતાને ચેતવવામાં આવે છે કે તે મિલકત અંગે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અને છતાં જો તે મિલકત અંગે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે તો તે અંગેની રકમ, વ્યાજ, ખર્ચ અને શુલ્ક બાબતે, બેંકને આધીન રહેશે. સિક્યોર્ડ એસેટ રીડીમ કરવા/પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભે કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઈઓ તરફ કરજદાર/ગીરો મૂકનારનું ધ્યાન દોરવામાં આવે છે.

हे दाहारनुं नाभ, सोन ખા ता नं.	મોર્ટગેજ મિલકતનું વર્ણન (સિક્ચોર્ડ એસેટ)	ડિમાન્ડ નોટિસની તારીખ	સાંકેતિક કબજા અંગેની નોટિસની તારીખ	િકમાન્ડ નોટિસની તારીખ મુજબ બાકી રકમ
શ્રી જીતેન્દ્રકુમાર લાલપ્રતાપ સિંહ શ્રીમતી ગરિમા ત્રિભુવન સિંહ ૧૧૦/૬૪૬૧	બધી જ ચલ અને અચલ સ્થાવર સંપત્તિ કોન્સો બ્લોક નંબર ૯૮૦, બ્લોક–ટી, ફ્લેટ નં. ટી/૧૦૨, ગ્રાઉન્ડ ફ્લૉર, ગૅલેક્સી ફ્લેટ, લુણાસણ રોડ, હાઇવે, છત્રાલ, તાલુકો કલોલ, જિદ્ધો ગાંધીનગર– ૩૮૨૭૨૯ સ્થિત છે અને તેની ચતુર્દિશા નિમ્નલિખિત છે. ઉત્તરઃ ફ્લેટ નંબર ટી/૧૦૨, પૂર્વઃ માર્જિન સ્પેસ અને બ્લોક–એસ, પશ્ચિમઃ પૅસેજ અને ફ્લેટ નંબર ૧૦૫, દક્ષિણઃ ફ્લેટ નંબર ટી/૧૦૩	২ ৭.0৭. २ 0२२	૨૬.૦૫.૨૦૨૨	₹.८,∈0, Ч४४.७४

અધિકૃત અધિકારી બંધન બેંક લિમિટેડ